

Super Visa/ Visitor to Canada Insurance

Best Mortgage Rates
1st and 2nd Mortgages
Life and Critical Illness Insurance
RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
Serving at 2 locations
GTA East / GTA West
Investment | Insurance | Mortgages

परदेशां देशी महेक अटले

स्वदेश

केनेडाथी प्रसिद्ध थतुं सर्वोत्तम गुजराती साप्ताहिक SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dr: 647-995-5640
amit@shahrealty.com

KOMAL SHAH
Sales Representative
Dr: 647-624-5640
komal@shahrealty.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 15 JULY, 2022 Vol. 19, No. 28 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

ગુજરાતમાં મેઘાનું તોફાન, 40 હજારનું સ્થળાંતર

રાજ્યમાં 164 તાલુકામાં ધોધમાર વરસાદ, 5400 ગામોમાં અંધારપટ NDRFની 19 ટીમ, SDRFની 22 લાટુન અને 1 ટીમ તૈનાત કરાઈ નવસારી જિલ્લામાં પૂરમાં ફસાયેલા અનેક લોકોને એરલિફ્ટ કરાયા

ગુજરાત રાજ્યના અઠવાડિયાથી ઘમરોળી રહેલા મેઘરાજાએ ગુરુવારે પણ તેની મહેર જારી રાખી હતી. જેને કારણે 24 કલાકમાં 40 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કુદરતી આફતને પગલે રાજ્ય સરકારે 7થી વધુ જિલ્લાઓમાં રેડએલર્ટ જાહેર કર્યું હતું.

ગુરુવારે સાંજ સુધીના ૧૮ કલાકમાં રાજ્યના કુલ ૧૬૪ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વલસાડ કપરાડામાં ૧૧ ઈંચ, ડાંગના સુબીરમાં ૮.૪૪ ઈંચ, પારડીમાં ૮ ઈંચ, ધરમપુરમાં ૮.૫૨ ઈંચ, નવસારીમાં ખેરગામમાં ૭.૫૬, વડોદરાના ડભોઈમાં ૮ ઈંચ, વાસંદામાં ૬.૮૮, વલસાડમાં વાપી ૬.૮૮ ઈંચ, નર્મદાના નાંદોદમાં ૭ ઈંચ, ડાંગના આહવામાં ૬.૦૮ ઈંચ, ડાંગ વઘઈમાં ૫.૫૬ ઈંચ, કરજણમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. રાજ્ય સરકાર દ્વારા ડાંગ, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથમાં રેડએલર્ટ જાહેર કરી બે દિવસ તંત્રને સતર્ક રહેવા આદેશ કરાયો હતો.



39,177નું રેસ્ક્યૂ, 5467 ગામમાં વીજળી ડુલ

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 39,177 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા કુલ 570 નાગરિકોનું રેસ્ક્યૂ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યના 7 જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદવાળા નવસારી, ચીખલી અને ગણદેવી વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે છે. રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 19 એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે, જ્યારે 1 ટીમ રિઝર્વ રખાઈ છે. જ્યારે 22 એસડીઆરએફની પ્લાટુન અને એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની ચાર પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. તા.7 જુલાઈથી અત્યાર સુધીમાં 43 માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. તે ઉપરાંત 477 પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યના ગામોમાં કાર્યરત 14,610 એસટી બસના રૂટમાંથી સલામતીના કારણોસર 148 ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. 18 હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત 5,467 ગામોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો.

કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરાઈ

કેનેડાના ટોરન્ટો ખાતેના ભારતના વાણિજ્ય દૂતાવાસે ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનાને અનુલક્ષીને દ્વિવટ કર્યું છે. દ્વિવટના માધ્યમથી દૂતાવાસે લખ્યું હતું કે, અમે રિયમંડ હિલ ખાતેના વિષ્ણુ મંદિરમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવામાં આવી હોવાથી દુઃખી છીએ. તોડફોડના આ ગુનાહિત કૃત્યે, નફરતથી ભરેલી આ ઘટનાએ કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. કેનેડાની સ્થાનિક પોલીસ અનુસાર યોગ સ્ટ્રીટ ગાર્ડન એવન્યુ વિસ્તારમાં આવેલા વિષ્ણુ મંદિરમાં સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર કાળી સ્યાહીથી અભદ્ર શબ્દો પણ લખવામાં આવ્યા હતા. અધિકારીઓને બુધવારના રોજ આશરે 12.30 વાગ્યે આ ઘટનાની જાણકારી મળી હતી. આ મામલે કેનેડાની સ્થાનિક પોલીસે કહ્યું હતું કે તેઓ આ ઘટનાની હેટ કાર્ડમ તરીકે તપાસ કરી રહ્યા છે.

પૂર્ણાના પૂરમાં નવસારી ડુબ્યુ : નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો

PAGE NO. 14

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINCE 1981

MAAZ ABOWATH
BROKER
416 893 4585

More info on PAGE 2 વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

Residential
New Condos
Investments
Commercial

દુરમાં યાદ રાખો

Zakir Patel
Broker

Cell: 416-561-7973
Office : 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1245, Morningside Ave. #203
Toronto, ON M1B 3Y9
Email : patelzakir82@gmail.com

SUPER VISA INSURANCE

Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

છેલ્લા ૪૪ વર્ષથી ટોરન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ યશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Closing down sale !
Japanese Sarees, UK Sweaters and much more at attractive prices.

Upto **80% off**

• \$1 each Blouse Piece • 3 for \$100 Gold Print Jacquard Sarees. • 4 for \$100 Gold Print Sarees.
• 5 for \$100 UK Sweaters. • 10 for \$100 Printed Georgetown Sarees. • 20 for \$100 Japanese Plain Suit Pcs
and many more specials...

Biggest Sale Ever! Just in Time for the festive season!

Uma Sarees
6270 Côte des Neiges, Montreal
514-341-1394

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002



તંત્રી સ્થાનેથી

વંશવાદને વરેલા રાજકારણના પાપે આખું શ્રીલંકા પાયમાલ

શ્રીલંકામાં વંશવાદને વરેલા રાજકારણે આખા શ્રીલંકાને કંગાળ કરી દીધો છે. છેલ્લા ઘણાં મહિનાઓથી શ્રીલંકાના લોકો રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેનો વિરોધ કરી રહ્યા છે. શ્રીલંકામાં સર્જાયેલી આ પરિસ્થિતિ માટે ગેરવહિવટ જ જવાબદાર છે. દેશ ચલાવવા માટે ધિરાણ લેવાનો સિલસિલો ચાલુ રહ્યો અને તેને કારણે રાજકીય ખાધ વધતા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા. આ સાથે જ જીવનજરૂરી સુવસ્તુઓ એટલી હદે મોંઘી થઈ કે, નાગરિકો રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા.

તંત્રી - પ્રકાશક
સ્વદેશ

શ્રીલંકામાં વંશવાદને વરેલા રાજકારણે આખા શ્રીલંકાને કંગાળ કરી દીધો છે. છેલ્લા ઘણાં મહિનાઓથી શ્રીલંકાના લોકો રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેનો વિરોધ કરી રહ્યા છે. શ્રીલંકામાં સર્જાયેલી આ પરિસ્થિતિ માટે ગેરવહિવટ જ જવાબદાર છે. દેશ ચલાવવા માટે ધિરાણ લેવાનો સિલસિલો ચાલુ રહ્યો અને તેને કારણે રાજકીય ખાધ વધતા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા. આ સાથે જ જીવનજરૂરી સુવસ્તુઓ એટલી હદે મોંઘી થઈ કે, નાગરિકો રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા.

લંકામાં રાજપક્ષે પરિવાર સત્તાના કેન્દ્રસ્થાને હતો ત્યારે તેમણે પોતાનું ઘર જ ભર્યું. શ્રીલંકાની સરકારમાં રાજપક્ષે પરિવારના પાંચ સભ્ય મંત્રી હતા. ગોટબાયા રાજપક્ષે પોતે પ્રમુખ હતા, જ્યારે વડાપ્રધાનપદે તેમના ભાઈ મહિન્દા રાજપક્ષે હતા. નાણામંત્રી બાસિલ રાજપક્ષે મહિન્દા-ગોટબાયાના નાના ભાઈ છે જ્યારે સિંચાઈ મંત્રી રહી ચૂકેલા ચમલ રાજપક્ષે તેમના મોટાભાઈ છે. ચમલ રાજપક્ષે ૭૯ વર્ષના છે પણ સત્તાનો મોહ જ છૂટતો નથી. રમતગમત મંત્રી નમલ રાજપક્ષે મહિન્દા રાજપક્ષેનો સૌથી મોટો પુત્ર છે. ૩૬ વર્ષનો નમલ રાજપક્ષે પરિવારનો રાજકીય વારસ ગણાય છે. શ્રીલંકાના બજેટની ૭૦ ટકા રકમ આ પરિવારના પાંચ લોકોની મુનસફી પ્રમાણે વપરાતી હતી. રાજપક્ષે પરિવારે ૫.૩૧ અબજ ડોલર અથવા ૪૨ હજાર કરોડ રૂપિયા સગેવગે કરીને વિદેશની બેંકોમાં જમા કરાવી દીધાનો આક્ષેપ પણ તેમની સામે મુકાયો છે.

શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર તરીકે મહિન્દા રાજપક્ષેના નજીકના સાથી અજિત નિવાર્ડ કેબ્રાલ હતા. તેની મદદથી આખો ખેલ કરાયો હોવાની આશંકા છે. શ્રીલંકાની બરબાદીનું મૂળ સરકારની આવક કરતાં વધુ ખર્ચ કરવાની નીતિ પણ છે. શ્રીલંકામાં જેટલી આયાત થતી હતી તેના કરતાં ઓછી નિકાસ થતી હતી, જેને કારણે હુંડિયામણની સતત તંગી રહેતી હતી. આ તંગીમાંથી રસ્તો કાઢવા શ્રીલંકાની સરકાર સતત વર્લ્ડ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લોન લેતી હતી અને ગાડું ગબડાવતી હતી. આ લોનને કારણે એક બાજુ દેશ દેવાદાર બનતો ગયો તો શાસક વર્ગ ભ્રષ્ટાચાર થકી સમૃદ્ધ બનતો ગયો હતો. બે વર્ષ પહેલાં કોરોનાનું તોફાન આવ્યું તેને કારણે પર્યટકો શ્રીલંકામાં આવતાં બંધ થઈ ગયાં. પર્યટનવ્યવસાયને કારણે જે વિદેશી હુંડિયામણ મળતું હતું તે બંધ થઈ ગયું.

બીજી બાજુ શ્રીલંકાનાં જે નાગરિકો વિદેશમાં રહીને કરોડો ડોલર કમાઈને મોકલતાં હતાં તેમની નોકરી જવાથી તેમના થકી આવતાં ડોલરનો પ્રવાહ મંદ પડી ગયો. ડોલરની આવક ઘટી ગઈ, પણ જાવકમાં ઘટાડો ન થવાને કારણે ડોલરના મર્યાદિત ભંડારો પણ ખાલી થઈ ગયા. ત્યાં સુધી કે જરૂરી અનાજ, દવાઓ અને ખનિજ તેલની આયાત કરવા માટે પણ સરકાર પાસે ડોલર રહ્યા નહીં. સરકારે જે વિદેશી દેવું કર્યું છે, તેનો આંકડો ૫૧ અબજ ડોલર જેટલો છે. તેની સામે તેણે આ વર્ષે વ્યાજના રૂપમાં જ સાત અબજ ડોલર ચૂકવવાના છે, પણ ૨૦૨૨ ના માર્ચમાં તેની પાસે ૧.૮ અબજ ડોલરનું અનામત ભંડોળ જ હતું. આ વ્યાજ પણ ચૂકવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.

આજે વાત એટલે સુધી વણસી કે, શ્રીલંકામાં અંધાધૂંધી ફેલાઈ છે. ખાવા-પીવાની ચીજો મળવી પણ મુશ્કેલ થઈ છે. આખા શ્રીલંકામાં ભૂખમરા જેવી હાલત થઈ જતાં શનિવારે અકળાયેલા લોકોએ રાષ્ટ્રપતિના નિવાસને ઘેરી લીધું અને આર્મી તથા પોલીસના જવાનોની ઐસીતેસી

કરીને ઘરમાં ઘૂસી ગયા. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને પહેલાંથી જ લોકોના આકોશનો અંદાજ આવી ગયો હતો તેથી તેઓ ઘરેથી ભાગી ગયા અને આર્મી હેડક્વાર્ટરમાં જઈને છૂપાઈ ગયા. જ્યાંથી ગોટબાયાએ રાજનામું આપવાની જાહેરાત કરી નાંખી. ગોટબાયાનો અંજામ પણ તેમના નાના ભાઈ મહિન્દા રાજપક્ષે જેવો આવ્યો છે. મે મહિનાની શરૂઆતમાં મહિન્દા રાજપક્ષે વડાપ્રધાન હતા ત્યારે લોકોએ આ રીતે જ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનનો ઘેરાવ કરીને હલ્લાબોલ કરી દીધું હતું. મહિન્દાના રાજનામા પછી રાનિલ વિક્રમસિંહે ૧૨ મેના રોજ વડાપ્રધાન બન્યા હતા પણ તેમણે બે મહિના સુધી મથામણ કર્યા પછી શનિવારે રાજનામું ધરી દેતાં રાજપક્ષે પરિવાર તરફ લોકોનો ગુસ્સો વધી ગયો. શ્રીલંકાના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ(સીડીએસ) જનરલ શવેન્દ્ર સિલ્વાએ લોકોને લશ્કરને સમર્થન આપીને સ્થિતિને સામાન્ય કરવા અપીલ કરી છે. પણ અત્યારે જે સ્થિતિ છે એ જોતાં લોકોનો ગુસ્સો ઠંડો પડે એવી શક્યતા ઓછી છે. શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ જેવી ચીજો તો સાલ્લબી બની ગઈ છે. આવા સંજોગોમાં બે મહિના પહેલાં જ વડાપ્રધાન બનેલા રાનિલ વિક્રમસિંહે પોતે જનાકોશનો ભોગ બની ગયા. લોકોએ કોલંબોમાં વિક્રમસિંહેનું ઘર સળગાવી દીધું. આ અંગની જાણ કોલંબો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગને મિનિટોમાં કરાઈ. ફાયર સ્ટેશનથી વિક્રમસિંહેનું ઘર બે કિલોમીટર દૂર જ આવેલું હોવા છતાં ફાયર બ્રિગેડ આગ બુઝાવવા ના જઈ શક્યું. લંકામાં લોકોનો આકોશ જોતાં સ્થિતિ હજુ સ્ફોટક બનશે તે નક્કી છે. આ આકોશનું નિશાન રાજપક્ષે પરિવાર છે તેથી રાજપક્ષેનો પરિવાર હાલ શ્રીલંકામાંથી માલ્દિવ થઈ સીંગાપોર પહોંચ્યો હોવાનું મનાય છે.

લંકામાં અત્યારે જે સ્થિતિ છે તેમાં આઈએમએફએ મદદની તૈયારી બતાવી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ સત્તાવાર રીતે કહ્યું છે કે, શ્રીલંકાની રાજકીય ઉથલપાથલનો ઉકેલ આવે અને હિંસા શમી જાય તો લંકાને આર્થિક પેકેજ માટેની વાટાઘાટો કરાશે. આઈએમએફ વિશ્વમાં આર્થિક મુશ્કેલીમાં મૂકાયેલા તમામ દેશોને તકલીફમાંથી બહાર કાઢવા પેકેજ આપે છે. પરંતુ માટે સબસિડી બંધ કરવી, ખર્ચ ઘટાડવા, આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવી સહિતની શરતોનું પાલન કરવું પડે છે. ભારત પણ ૧૯૯૦ના દાયકામાં આઈએમએફની મદદથી આર્થિક મુશ્કેલીઓના દોરમાંથી બહાર આવ્યું હતું. પણ એ પહેલાં હિંસાબંધ થાય અને રાજકીય સ્થિરતા સ્થપાય એ જરૂરી છે. લોકોનો આકોશ જોતાં પોતાની રીતે લોકો ઘરોમાં જવાનાં નથી. તેથી હવે લશ્કર મેદાનમાં આવીને સ્થિતિ સંભાળે તે જ વિકલ્પ બચ્યો છે.

બીજી તરફ ગોટબાયા રાજપક્ષેએ સીંગાપોરથી સ્પીકરને રાજનામું મોકલી આપ્યાનું કહેવાય છે. હવે લંકાની સંસદ કોઈ સાંસદને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરશે. ગોટબાયાના રાજનામાના એક મહિનાની અંદર નવી નિમણૂક કરવી જરૂરી છે. સાથે સાથે ત્રણ દિવસમાં સંસદની બેઠક બોલાવવી પણ જરૂરી છે. ગોટબાયા બળતું ઘર મુકીને ભાગ્યા હોવાથી અત્યારે કોઈ રાષ્ટ્રપતિ બનવા તૈયાર નથી. એ જોતાં કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવીને કામ ચલાવાય એવું બને. તેના માટે પણ વડાપ્રધાનપદ છોડનારા રાનિલ વિક્રમસિંહે સિવાય બીજો વિકલ્પ ન હોવાથી વિક્રમસિંહે એક મહિના સુધી કાર્યકારી રાષ્ટ્રપતિ બને અને એ દરમિયાનમાં સરકાર રચીને કારભાર કરાય એ શક્ય છે. સંસદ નવા રાષ્ટ્રપતિની પસંદગી ન કરે ત્યાં સુધી કેબિનેટ મંત્રીઓમાંથી કોઈને રાષ્ટ્રપતિની ઓફિસમાં નિમણૂક કરાય એ પણ શક્ય છે.

મનોજ ગાંધી
manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com




- ✓ Mice
- ✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL




- ✓ Cockroach
- ✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI




- ✓ Animal Control
- ✓ Bird Control
- ✓ WASPS and
- ✓ Hive Removal

**24 HRS / 7 DAYS EMERGENCY SERVICES
AND ANIMAL REMOVAL**

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.
Written Guarantee And
Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator



DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!
: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta



માઈ ભક્તો આનંદો... તારંગા-અંબાજી-આબુ રોડને હવે રેલવે નેટવર્કથી જોડાશે

અમદાવાદ

યાત્રાધામ અંબાજીને રેલવે નેટવર્ક સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીને રેલવે નેટવર્કની સાથે સાથે તરંગા-આબુ-અંબાજી-આબુ રોડને રેલ લાઈનથી જોડાશે. નવી રેલ લાઈનને કેબિનેટ મંજૂરી આપી દેવામાં આવી છે.

મહેસાણા-તારંગા રેલવે લાઈનને વાયા અંબાજી થઈ આબુરોડ સુધી લંબાવવાના રૂ. 2798 કરોડના પ્રોજેક્ટને કેન્દ્રના રેલવે મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતની રેલવે કનેક્ટિવિટી પ્રદાન કરવા અને વિકાસમાં ગતિ આપવા માટે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઈનને મંજૂરી આપી. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2798.16 કરોડ અને 2026-27 સુધીમાં પૂર્ણ થશે. નોંધનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકારે રૂ.1695.72 કરોડના ખર્ચે વરેદા રેલવે સ્ટેશનથી વાયા અંબાજી થઈ આબુ રોડ સુધી રેલલાઈન લંબાવવા યોજના ઘડી હતી. મહેસાણાથી તારંગા સુધી રેલવે લાઈન નંખાઈ ગયા બાદ આગળનું

કામ શરૂ નહીં થતાં સાંસદ ભરતસિંહ ડાભીએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલય દ્વારા રૂ. 2798.16 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવનાર તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઈનના નિર્માણને મંજૂરી આપી છે.

નવી રેલ લાઈનની કુલ લંબાઈ 116.65 કિલોમીટર હશે. આ પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ લગભગ 40 લાખ કામકાજ માટે બાંધકામ દરમિયાન સીધી રોજગારીનું સર્જન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ, આ પ્રોજેક્ટ કનેક્ટિવિટી વધારશે અને ગતિશીલતામાં સુધારો કરશે જેનાથી પ્રદેશનો એકંદર સામાજિક આર્થિક વિકાસ થશે.

અંબાજી એ એક પ્રખ્યાત મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે અને તે ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે અને દર વર્ષે ગુજરાત તેમજ દેશના અન્ય ભાગો અને વિદેશમાંથી લાખો ભક્તોને આકર્ષે છે.

મહેસાણા જિલ્લા સહકારી બેન્કના ડિરેક્ટર દલજીભાઈ ચૌધરીને હોદ્દા ઉપરથી દૂર કરાયા

મહેસાણા

મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ડિરેક્ટર દલજી ચૌધરીને હોદ્દા ઉપરથી દૂર કરાયા છે. ડિરેક્ટર બેન્કની મંગળવારે કડીમાં મળેલી બોર્ડ મીટીંગમાં જિલ્લા સહકારી રજિસ્ટ્રારે લખેલા પત્રને વંચાણે લઈને કાર્યવાહી કરાઈ હતી. વધવાડી સેવા સહકારી મંડળીમાં ટ્રેક્ટર વેચી મારવાની ગેરરીતિમાં સહકારી મંડળી અધિનિયમની કલમ હેઠળ દલજી ચૌધરીને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ખેરાલુ તાલુકાના

વધવાડી ગામની સેવા સહકારી મંડળીમાં ટ્રેક્ટર વેચી મારવાની ગેરરીતિમાં જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પ્રમુખપદેથી દલજી ચૌધરીને દૂર કરી હોદ્દો ધારણ કરવા માટે હુકમની તારીખથી 3 વર્ષ સુધીની મુદત માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેથી દલજી ચૌધરીએ અધિક રજિસ્ટ્રાર(અપીલ) સમક્ષ રીવીઝન અરજ કરતાં જિલ્લા સહકારી રજિસ્ટ્રારના હુકમને રદ કર્યા હતા. તેથી અરજદાર ભગવાન ચૌધરીએ નાયબ સચિવ (અપીલ) સમક્ષ રીવીઝન અરજ કરી હતી.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 : Our disinfectant services that we offer are:


- 1 Spray Services
- 2 Fogging Services
- 3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets



Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, કટલેસ, ખાસ્તા કચોરી, સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી (with sweet & Farsan) \$9.00 +Tax

Limited થાળી (without sweet & Farsan) \$7.50 +Tax



CATERING SPECIAL

\$ 14.99 10 items +Tax
Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

સુરત જિલ્લાનું પ્રાકૃતિક કૃષિ મોડેલ વિશેષ ક્ષમતા ધરાવે છે: મોદી

સંમેલનમાં વડાપ્રધાને વર્ચ્યુઅલી હાજરી આપી કહ્યું કે, ગુજરાતના ગામડાઓ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે

સુરત

સુરતમાં રવિવારે પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી કહ્યું કે, સુરત જિલ્લાનું પ્રાકૃતિક કૃષિ મોડેલ સમગ્ર ભારત દેશનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત ખેડૂતોએ સાબિત કર્યું છે કે, ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી, પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે.

સુરતના પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે,, દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ

ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારનો આધાર બની જશે. સુરત જિલ્લાનું પ્રાકૃતિક કૃષિ મોડેલ સમગ્ર ભારત દેશનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. જિલ્લાના ૬૯૩ ગામોની ૫૫૬ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૪૧,૭૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડ્યા છે.

વિશ્વમાં બેક ટુ બેઝીકની પ્રણાલી શરૂ થઈ છે : મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેથી ગુજરાતનો પ્રત્યેક કિસાન ઝેર મુક્ત ખેતી કરવાનો સંકલ્પ લે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ ખર્ચ ઘટશે, આરોગ્યદાયક ખાદ્યાન્ન મળશે તથા પર્યાવરણની રક્ષા થશે. તેમણે ઉમેર્યું કે, આવનારી પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે. સમગ્ર વિશ્વમાં બેક ટુ બેઝીક એટલે કે કુદરત તરફ પાછા ફરવાની પ્રણાલી શરૂ થઈ છે. વધુમાં કહ્યું કે, રાજ્યના ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે આવનાર દિવસોમાં વધુને વધુ ખેડૂતોને વડાપ્રધાન અને રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે અને એક સમયે 'સોને કી ચીડીયા' કહેવાતું ભારત પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ બનશે

સુરતની સ્કૂલમાં ભણતર સાથે શીખવાડાય છે માનવતા અને દેશભક્તિના પાઠ

સુરત

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર પેટલીકર સ્કૂલ આવી છે. શિક્ષણ સમિતિની સ્કૂલ હોવા છતાં અહીં પણ શિક્ષણનું સ્તર વધુ સારું હોવાથી એડમિશન માટે વાલીઓએ મહેનત કરવી પડે છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે દેશ પ્રેમ અને એક બીજાને મદદરૂપ થવાના પાઠ પણ ભણાવવામાં આવે છે. શિક્ષકોની આવી મહેનતના કારણે આ ગરીબ વિદ્યાર્થીઓ પોતાના અન્ય સાથીઓ સાથે સાથે દેશમાં ફરજ બજાવતાં શૈનિકોના કલ્યાણ માટે પણ ફાળો ભેગો કરે છે. શાળાના આચાર્ય વૈશાલી સુતરિયા કહે છે, અમારી શાળામાં દેશદાઝના પાઠ ભણાવતા હોવાથી વિદ્યાર્થીઓમાં દેશના સૈનિકો પ્રત્યે વધુ લાગણી છે.

સુરતમાં કોર્ટ બિલ્ડીંગના ચોથા માળેથી આરોપી કાપડ દલાલની મોતની છલાંગ

સુરત

સલાબતપુરા પોલીસે ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે ઉધાર કાપડની ખરીદીના પેમેન્ટના મુદ્દે ઠગાઈના કારસા બદલ અગાઉ બે ગુનામાં ઝડપ્યા બાદ જામીન મુક્ત આરોપી કાપડ દલાલને ત્રીજા ગુનામાં રિમાન્ડ મેળવ્યા બાદ કોર્ટે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલતા આજે મોડી સાંજે ૪૩લાકે આરોપીએ કોર્ટ અગમ્ય કારણોસર ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી મોતને ઝાલું કરી લેતા કોર્ટ સંકુલમાં ચકચાર મચી જવા પામી હતી.


બમરોલી રોડ સ્થિત આત્માનંદ તથા

એસ.કે.નગર ઈન્ડસ્ટ્રીયલ વિભાગમાં માધવ ટેક્સટાઈલ નિલમ ફેબ્રિક્સ, જીનલ ફેબ્રિક્સ સહિત અન્ય પેઢીઓના નામે વિસ્ફોજ કાપડના ઉત્પાદન વેચાણ કરતા ફરિયાદી પિયુષ ડાહ્યાભાઈ બારોડોલીયા(રે. સંત તુકારામ સોસાયટી,ઘોડદોડ રોડ)એ ગઈ તા. ૭મી જુલાઈના રોજ સલાબતપુરા પોલીસમાં રીંગરોડ કોહીનુર માર્કેટ સ્થિત ખુશાલ ઈમ્પેક્શન આરોપી સંચાલક ગીરીશ ગુલાબસિંગ પારેખ (રે.ભટારરોડ) તથા કાપડ દલાલ ભરતકુમાર જયકિશનદાસ તાલીયા(રે.સિધ્ધી શેરી,સલાબતપુરા) વિરુદ્ધ ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

સરસાણા કન્વેન્શન સેન્ટરમાં ૨૩મીથી ત્રણ દિવસીય વીવનીટ એક્ઝિબિશન

સુરત

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તા. ૨૩થી ૨૫ જુલાઈ દરમિયાન સરસાણામાં વિવનીટ એક્ઝિબિશન-૨૦૨૨નું આયોજન કર્યું છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી કરશે. સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિક્સ પ્રદર્શનની થીમ રહેશે, પ્રદર્શનમાં ૧૫૦ જેટલા એક્ઝિબિટર્સ ભાગ લેશે, એમ ચેમ્બરના પ્રેસિડેન્ટ ઈલેક્ટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું હતું. ચેરમેન દીપકપ્રકાશ અગ્રવાલે જણાવ્યું કે, દેશભરની મુખ્ય કાપડની મંડીઓ ઈન્દોર, કટક, જયપુર, પૂણે, હૈદરાબાદ, બેંગલોર, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

ZIVASA
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana
Broker

કોલવડા હત્યાકાંડ: પ્રેમી સાથે મળી પતિની હત્યા, પ્રેમીની પત્નીની પણ ધરપકડ કરાઈ

ભાગમાં આવતી ત્રણ વિદ્યા જમીન મેળવવા માટે પ્રેમી સાથે મળીને પ્લાન ઘડયો

ગાંધીનગર

ગાંધીનગર કોલવડામાં રહેતા ઘનશ્યામ પટેલની હત્યા તેની પત્ની રીશીતા અને સગીરવધની પુત્રીએ કરી હતી. ઘનશ્યામે પુત્રી ઉપર નજર બગાડતી રીશીતાએ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. પરંતુ આ ઘિયરી પોલીસના ગળે ઉતરતી ન હતી. જેના પગલે રીશીતાના ફોનની ડિટેઈલ પણ કઢાવી હતી અને પેથાપુર પોલીસે હત્યાકાંડના મુળ સુધી પહોંચવા માટે મથામણ શરૂ કરી હતી. દરમિયાનમાં પોલીસને વિગતો મળી હતી

કે, ઘરકંકાસથી કંટાળી રીશીતા અમદાવાદ ગઈ હતી તે વખતે તેની બહેનપણી સોનલ અને તેના પતિ સંજય પટેલે મદદ કરી હતી. આ જ સમયે રીશીતા અને સંજય વચ્ચે આંખો મળી ગઈ હતી. ઘનશ્યામના ભાગમાં ત્રણ વિદ્યા જમીન પણ આવવાની હતી. તેના પગલે રીશીતા અને સંજયે ઘનશ્યામની હત્યાનો પ્લાન ઘડયો હતો જે મુજબ દોઢ મહિના અગાઉ પુત્રીને કોલવડા રહેવા માટે મોકલી હતી અને ત્યાર બાદ રીશીતા પણ કોલવડા પહોંચી હતી. જ્યાં નક્કી થયેલા પ્લાન મુજબ

રીશીતાએ ફોન કરીને સંજય અને તેની પત્નીને બોલાવી દીધા હતા ઘનશ્યામને જમવામાં ઉઘની ગોળીઓ આપવામાં આવી હતી. તેથી તે ઉઘમાં હતો તે દરમિયાન જ સંજયે માથામાં દસ્તો માર્યો હતો અને ઘનશ્યામના મોઢામાંથી બુમ નિકળતા રીશીતાએ મોઢું દબાવી દીધું હતું પ્રેમીની પત્ની સોનલ અને પુત્રીએ ઘનશ્યામના પગ પકડી રાખ્યા હતા આ હત્યાને અંજામ આપ્યા બાદ સંજય અને તેની પત્ની મોપેડ ઉપર અમદાવાદ જવા માટે નિકળી ગયા હતા.

ખેડા કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાયું 69 જેટલા હોદ્દેદારો ભાજપમાં જોડાયા

ધીરુભાઈ ચાવડાએ પંજાને બાય બાય કરતા કોંગ્રેસ હાઈ કમાન્ડ ઊંઘતું ઝડપાયું

નડિયાદ

ખેડા જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાવતો હતો. ભાજપાએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા કમર કસી છે. ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના પૂર્વ ચેરમેન સહિત 6૯ જેટલા હોદ્દેદારોએ સાગમટે કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે

પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જવા હોડ જામી હોય તેમ કોંગ્રેસના ગઢ ગણાતા ખેડા જિલ્લામાં પીઠ કોંગ્રેસ નેતા ધીરુભાઈ ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા, મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ઠાસરા જિલ્લા પંચાયત સભ્ય નાગરાજ સિંહ ઠાકોર તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિત ૬૯ જેટલા હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધા છે. આ ૬૯ જેટલા હોદ્દેદારોએ પક્ષમાં બળવો કરી રાજીનામું આપી ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે કેસરિયો કેસ અને ટોપી પહેરી ભાજપમાં જોડાયા હતા.

વડોદરાના હરીશ અમીનની હત્યાનું સિંઘરોટરોડ સુધી રિકન્સ્ટ્રક્શન થયું

વડોદરા

વડોદરા નજીક શેરખીમાં સોનારકુઈ ગામ નજીક અમીન ઓચિંડ ફાર્મના ૬૮ વર્ષના માલિક હરીશ દાદુભાઈ અમીનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓના પોલીસે શુક્રવાર સુધી રિમાન્ડ મેળવ્યા બાદ આજે આરોપીને સાથે રાખી સિંઘરોટ પર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

બે માસ પહેલાં ભીમપુરા-સિંઘરોટરોડ પર વડોદરા તરફ વહેલી સવારે પાંચ વાગે ઈકો ગાડીમાં સળગી જવાથી ભડયું થઈ ગયેલી હરીશભાઈ અમીનની લાશ મળ્યા બાદ તેમનું મોત આકસ્મિક નહી પરંતુ હત્યા કરવામાં

આવી હતી તે વાતનો પર્દાફાશ થયા બાદ પોલીસે હરીશભાઈના ફાર્મ પર અગાઉ કામ કરતા પ્રવિણ જેનુભાઈ માલીવાડ, તેના ભાઈ ભરત, પત્ની લક્ષ્મી અને સાગરીતો સોમા પર્વત બારીયા, સુખરામ ઉર્ફે સુખો શંભુભાઈ ડામોર અને સુનિલ રમેશ બારીયાની પોલીસે ધરપકડ કરી હતી. મંગળવારે બપોરે પોલીસે આરોપી સોમા પર્વત બારીયાને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હત્યાના મુખ્ય બે આરોપી પ્રવિણ અને ભરત બંને સોમાના ઘેર ગયા હતા અને ત્યાંથી તેઓ સાથે નીકળ્યા હતાં. પોલીસે બાપોદના ઘેર રંગવાટિકાથી રિકન્સ્ટ્રક્શન શરૂ કર્યું હતું.

આણંદમાં અષાઠી જોખાઈ : રાજ્યમાં સારી ખેતીનો વર્તારો, મૃત્યુદર વધવાનું અનુમાન

આણંદ

ઉમરેઠનાં અતિપ્રાચીન શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક આષાઠી પંચ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા તોલવામાં આવી હતી. જેમાં આ વર્ષે ડાંગર સહિતનાં પાક સારો થવાનો વર્તારો કરવામાં આવ્યો હતો. અષાઠીનાં વર્તારો પ્રમાણે આવનાર વર્ષ અઢાર આની રહેશે, એટલે કે ખૂબ જ સારું રહેશે. દરેક પાક ખુબ જ સારો થશે એવો વરતારો પ્રાપ્ત થયો છે. તલ

અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખુબ જ સારો રહેશે. ડાંગરનું પ્રમાણ વધારે હોવાથી તેનો પાક અને આધારીત વરસાદ પણ ખૂબ જ સારો રહેશે. આ સાથે માટી ત્રણ રતી ઓછી છે એટલે કે મૃત્યુનું દર વધારે ગણી શકાય.

ઉમરેઠ એ અતિપ્રાચીન નગરી છે. ભારતમાં તે છોટે કાશી તરીકે જાણીતું છે. કાશી અને ઉમરેઠની ઘણી બધી સામ્યતા છે. સમગ્ર ભારતમાં માત્ર કાશી અને આજ શિવાલયમાં ઐતિહાસિક આષાઠી

તોલવાની પરંપરા છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઠી તોલાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે દસ ધાન્ય જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. બીજા દિવસે સવારે એટલે કે અષાઠ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે.

SPOUSAL SPONSORSHIP SPECIALIST (98 percent success ratio)

Last minute student admission

Please contact us on

416-745-2466 or 91-9428973911

- Conestoga
- Seneca
- Humber
- Lambton
- Fanshawe
- Georgian
- Algoma
- Canadore
- Algoma polytechnic
- Mohawk

ONLINE IELTS SPOKEN ENGLISH CLASSES ON ZOOM

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS / DETENTION REVIEWS / CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS

CANADA	94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855
VADODARA	101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817
AHMEDABAD	139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

: Specialized in :

Job Offer & LMIA

Entrepreneur

Investor Business

Self Employed

Farm Investor

Email.: info@siis.ca Website.: www.siis.ca



જહોન અબ્રાહમ મલયામલ ફિલ્મમાં પ્રોડ્યુસર બન્યો

મુંબઈ : છેલ્લા કેટલાય સમયથી સાઉથ સિનેમાના બોલીવુડ પર આક્રમણની વાતો ચર્ચાઈ છે. સાઉથની અનેક પ્રોડક્શન કંપનીઓ પાન ઇન્ડિયા ફિલ્મ બનાવી ભારતભરમાંથી કરોડો ડોલરો રહી છે. આવા સમયે અભિનેતા અને પ્રોડ્યુસર જહોન અબ્રાહમ જુદી ચાલ ચાલ્યો છે. તેણે મલયાલમ ભાષામાં ફિલ્મ બનાવી છે. જહોને મલયાલમમાં માર્ક નામની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ આગામી ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. જહોન જેએ એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે. તેના બેનર હેઠળ બનેલી ફિલ્મનું દિગ્દર્શન વિષ્ણુ શિવપ્રસાદે કર્યું છે.



સ્પર્દા

FRIDAY, 15 JULY, 2022

09



હું એ જ છું, જે મંદિરે પણ જાય છે અને બિકિની પણ પહેરે છે : સારા

મુંબઈ : સારા અલી ખાન બોલિવુડની ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. તે બીટાઉનની ટોચની ઉભરતી સ્ટાર છે. સારાને એક્ટિંગની સાથે સાથે ફરવાનો પણ ખૂબ જ શોખ છે. તે ઘણીવાર જુદી-જુદી જગ્યાએ આઉટિંગ કરતી જોવા મળે છે. હાલમાં સારા અલી ખાને કહ્યું હતું કે, તે સતત પોતાનો વિકાસ કરી રહી છે. તે એ જ છોકરી છે, જે મંદિર પણ જાય છે અને બીચ ઉપર બિકિની પણ પહેરે છે. સારાએ જણાવ્યું હતું કે, શૂટિંગના કારણે તેને પોતાની માતાથી 45 દિવસથી વધારે દૂર રહેવું પડ્યું નથી. તેને આ બાબતથી નફરત છે. તેણે કહ્યું હતું કે, આ છોકરી તમને સરપ્રાઈઝ આપતી રહેશે કારણકે તે પોતાની જાતને પણ સતત સરપ્રાઈઝ આપી રહી છે. સારાએ પોતાના પેરેન્ટ્સ સાથે વિતાવેલા ગોલ્ડન ટાઈમને યાદ કરીને જણાવ્યું હતું કે, દરેક વખતે ઉનાળાની રજાઓમાં હું મારા પેરેન્ટ્સ સાથે 'ધ પ્રોડ વે' અને 'ધ લાયન કિંગ'ના 'ધ લંડન થિયેટર' વર્લ્ડને જોવા જતી હતી. કેટલાક લોકો વિચારશે કે હું કેટલી પાગલ છું, જે એક જ પ્લેને વારંવાર જુએ છે પરંતુ હું આ પ્લેને જોવા માટે આવતા સમાહે પણ જઈ શકું છું. સારાએ આગળ જણાવ્યું હતું કે, જ્યારે હું મોટી થઈ રહી હતી, ત્યારે મને સમજાયું કે મારા પિતાને ઈતિહાસમાં ખૂબ જ રસ છે. અમે થે રોમ અને ફ્લોરેન્સ જતા હતા અને ત્યાંના દરેક મ્યુઝિયમમાં જતા હતા. સારાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં વિક્રી કૌશલ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ચાહકો તેની ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. સારા છેલ્લી વાર તેની ફિલ્મ 'અતરંગી' માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર અને ધનુષ સામે જોવા મળી હતી.

આથિયાએ મજાક ઉડાવી: મારાં લગ્નમાં મને જરૂર બોલાવજો



મુંબઈ : અભિનેત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ આવાનારા ત્રણ મહિનામાં લગ્ન કરવાના છે તેવી વ્યાપક ચર્ચા ચાલી રહી છે. જોકે, આથિયાએ આ ચર્ચા અંગે મજાક સાથે પ્રત્યાઘાત આપ્યો છે. આથિયાએ જણાવ્યું હતું કે મને આશા છે કે કમસે કમ મને આ લગ્નમાં જરૂર આમંત્રણ મળશે. આથિયા અને કેએલ રાહુલની રિલેશનશિપ જગજાહેર છે. બંનેના પરિવારો પણ તેમના સંબંધને સ્વીકારી ચુક્યાં છે. આથિયાની ફિલ્મ કારકિર્દી જોઈએ તેવી આગળ વધી નથી આથી તે વહેલી તકે પરણી જશે એવા અહેવાલો અવારનવાર પ્રગટ થયા કરે છે. તાજેતરમાં એક ચર્ચા અનુસાર આથિયા અને રાહુલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરી લેવાનાં છે અને તે માટે તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. હવે આથિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકદમ ફની પ્રત્યાઘાત આપતાં લખ્યું છે કે, આશા છે કે આગામી ત્રણ મહિના પછી થનારા મારા લગ્નમાં મને પણ આમંત્રણ આપવામાં આવશે. આ પહેલા પણ આથિયા અને કેએલ રાહુલના લગ્નની ચર્ચા થઈ હતી. તે પછી આથિયાના અભિનેતા ભાઈ અહાન તથા પિતા સુનિલ શેટ્ટીએ પણ હાલ આ લગ્નનું કોઈ આયોજન નહીં હોવાનું જણાવ્યું હતું.

સારા અને જહાન્વીની દોસ્તી બની મિસાલ, તસવીર જોઈને ચાહકો થઈ ગયા દીવાના

મુંબઈ : સારા અલી ખાન અને જહાન્વી કપૂર ટૂંક સમયમાં 'કોફી વિથ કરણ' સીઝન 7ના બીજા એપિસોડમાં જોવા મળશે. આ સિઝનના બીજા એપિસોડમાં સિલ્વિંગ બોલિવૂડ બેસ્ટીઝ અને સ્ક્રીન ફેવરિટ જહાન્વી કપૂર અને સારા અલી ખાન પોતાની વાતો શેર કરતી જોવા મળશે. સારા અલી ખાન અને જહાન્વી કપૂર એક સમયે એકબીજાના પારોશી હતા અને હવે બંને સારા મિત્રો બની ગયા છે.



હાલમાં જહાન્વી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સારા અલી ખાન સાથે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં સારા બ્લેક શર્ટ ડ્રેસમાં જોવા મળી છે જ્યારે જહાન્વી થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. જહાન્વી અને સારા આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

કોપી વિથ કરણના પ્રોમોમાં સારા અલી ખાને જણાવ્યું હતું કે, કે સાઉથ એક્ટર વિજય દેવરકોંડાને ડેટ કરવા માંગે છે. જહાન્વી ટૂંક સમયમાં ફિલ્મ 'ગુડ લક જેરી' અને સારા અલી ખાન 'ગૈસલાઈટ'માં જોવા મળશે.

કેટરિનાને લગ્નના છ મહિનામાં સાસુએ બધી રસોઈ શીખવાડી દીધી

મુંબઈ : લગ્ન પછી ઘણી બધી છોકરીઓ એકદમ ઠાવકી ગુહિણીમાં પડેાઈ જાય છે. બોલીવૂડ સ્ટાર કેટરિનાએ પણ પોતાની જાતને એક આદર્શ હાઉસવાઈફમાં રુપાંતર કરવા માંડી છે. લગ્ન પહેલાં માત્ર કોફી જાતે બનાવી શકતી કેટરિના હવે બધી જ રસોઈ બનાવતાં શીખી ગઈ છે. મૂળ એક બ્રિટીશ સિટિઝન કેટરિના હવે એક ભારતીય વહુ તરીકે પોતાની જાતને ઢાળી રહી છે. લગ્ન અગાઉ કેટરિનાને માત્ર કોફી જ બનાવતાં આવડતી હતી. પરંતુ હવે તે રોટી, પંજાબી સબ્જ અને રાઈસની અનેક વેરાયટી બનાવતાં શીખી ગઈ છે. વિકી કૌશલની માતા એટલે કે કેટરિનાની સાસુએ તેને બધી પંજાબી રસોઈ બનાવતાં શીખવાડી છે અને છ મહિનામાં તો પાક કલામાં ભારે નિપુણ થઈ ગઈ છે. વિકી કૌશલના માતા-પિતા અંધેરીમાં રહે છે. લગ્ન પછી વિકી અને કેટરિના જુદુ તારા રોડ પર એક એપાર્ટમેન્ટમાં શિક્ષક થઈ ગયાં છે. જોકે, જ્યારે પછા કુરસદનો સમય હોય ત્યારે વિકી અને કેટરિના અંધેરીમાં પહોંચી જાય છે અને ત્યાં સમગ્ર પરિવાર સાથે મળીને નિતનવાં ભોજનની જ્યાંત માણે છે. કેટરિના સાસુ પાસેથી રસોઈ શીખી છે અને હવે તે ખુદ સાસુને તેમની ફેવરિટ ડિશીઝ બનાવીને ખવડાવે છે.



IPLની શરૂઆત કરનાર લલિત મોદી 'મિસ યુનિવર્સ' સુસ્મિતા સેન સાથે કરશે લગ્ન

ભારતીય ક્રિકેટ ફેન્ટસી IPLને એક નવા આયામ પર પહોંચાડવામાં સૌથી મોટો શ્રેય આપનાર વિવાદાસ્પદ લલિત મોદીએ એક પોસ્ટ કરીને સમગ્ર બોલિવૂડ જગતમાં ખલબલી મચાવી દીધી છે.

56 વર્ષીય મોદીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ભારતની ટોચની અભિનેત્રી સુસ્મિતા સેન સાથે લાંબા સમયના રિલેશનશિપ બાદ પ્રભુતામાં પગલાં પાડશે તેવી સ્પષ્ટતા કરી છે. બિઝનેસમેન લલિત મોદીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી અને લખ્યું કે, " પરિવાર સાથે માલદીવ અને સરદીનિયા સહિત ગ્લોબલ ટૂર કરીને લંડન પરત ફર્યા બાદ મારા બેટરલુક પાર્ટનર સુસ્મિતા સેનને હું કેમનો ભૂલી શકું-આખરે એક નવી શરૂઆત એક નવી જિંદગી.



ચંદ્રને પેલે પાર. ઈન્સ્ટા પોસ્ટની સાથે હવે મોદીએ પોતાનો ઈન્સ્ટા DP પણ બદલ્યો છે અને તેમના



નવા પાર્ટનર સાથેનો Pic મુક્યો છે. રસપ્રદ વાત એ છે કે બિઝનેસમેન લલિત મોદીની

ઉંમર 56 વર્ષ છે અને મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર સુસ્મિતા સેનની ઉંમર 46 વર્ષ છે એટલેકે 10 વર્ષ મોટા મોદી સાથે સેને લગ્ન કરવા તૈયારી બતાવી છે. આ અગાઉ પણ સુસ્મિતા અનેક ક્રિકેટના ટિગ્ગજ ખેલાડીઓ અને બિઝનેસ મેન સાથે રિલેશનશિપમાં હોવાની વાતો બહાર આવી હતી.

મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમ અને ભૂતપૂર્વ બ્યુટી ક્વીન સુસ્મિતા સેન એક ડાન્સ રિયાલિટી શો, 'એક ખિલાડી એક હસીના' સહ-જજ કરતી વખતે પ્રેમમાં પડ્યા હતા. જોકે લગભગ પાંચ મહિના પછી સુસ્મિતાની 2008માં લલિત મોદી સાથેની કથિત નિકટતાને કારણે બંનેનું બ્રેકઅપ થયું હતું.



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!
રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, સમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્વટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



એલન મસ્કના વલણ સામે ટ્વિટરની ધમકીથી કાનૂની જંગના અંધાણ


ટ્વિટરના સોદામાં એલન મસ્કની ગુલાંટ

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર ખરીદવામાં અંતે પીછે હઠ કરી છે. મસ્કે એપ્રિલમાં ૪૪ અબજ ડોલર આપીને ટ્વિટર કંપની ખરીદવાની જાહેરાત કરી ત્યારે છ મહિનામાં કંપનીને ટેઈકઓવર કરવાની પ્રક્રિયા પૂરી થઈ જશે એવો દાવો થયો હતો. પરંતુ જુલાઈ પુરો થાય તે પહેલાં જ મસ્ક પાણીમાં બેસી ગયા. મસ્કે આ અંગે ગત શુક્રવારે જાહેરાત કરી સ્પષ્ટ કર્યું હતું કે, હાલ તેઓ ટ્વિટર સાથેનો સોદો કરશે નહીં. કારણ કે, વારંવાર માગવા છતાં ટ્વિટર ફેક એટલે કે નક્કી એકાઉન્ટ્સ અંગેની વિગતો અમને આપતી નથી.

મસ્કની કંપનીએ એવી ચોખવટ પણ કરી છે કે, સોદો રદ નથી થયો, પણ હાલ પૂરતો મોકૂફ રખાયો છે. તેથી ભવિષ્યમાં સોદો થઈ પણ શકે. ટ્વિટરને ખરીદવાના પ્રયત્નો પહેલાં પણ થયા હતા પણ સફળ નહોતા થયા. ટ્વિટરનો આઈપીઓ ૨૦૧૩ના નવેમ્બરમાં આવ્યો તેના લગભગ ત્રણ વર્ષ પછી ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં ટ્વિટરને ખરીદી લેવા ટોચની કંપનીઓ દ્વારા સંપર્ક કરાયો હોવાની વાતો ફેલાઈ હતી. ટ્વિટર પાસે એ વખતે જ ૨૦ કરોડથી વધારે એક્ટિવ યુઝર્સ હતા. તેના કારણે મોટી મોટી કંપનીઓને ટ્વિટરની ખરીદીમાં રસ જાગ્યો હતો. ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઉપરાંત માઈક્રોસોફ્ટ, વેરિઝોન, સેલ્સફોર્સ, વોલ્ટ ડિઝની જેવી કંપનીઓને ટ્વિટરની ખરીદવામાં રસ હતો.

આ વાતો બહાર આવતાં જ ટ્વિટરના શેરના ભાવમાં મહિનામાં ૨૦ ટકાનો ઉછાળો વર્તાયો હતો. તે સમયે ટ્વિટરના બોર્ડે આ અંગે તેને ઓફર મળી હોવાનું સ્વીકાર્યું હતું સાથે જ યોગ્ય ઓફર માટે બોર્ડનું વલણ હકારાત્મક હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. બોર્ડે એવું પણ કહ્યું હતું કે, ૨૦૧૬ના અંત સુધીમાં સોદો થઈ શકે છે. જો કે, ભારે સસ્પેન્સ પછી ઓક્ટોબરમાં જાહેર કરાયું કે, ટ્વિટર નહીં વેચાય. આ વખતે સત્તાવાર રીતે કોઈ કારણ નહોતું અપાયું પણ ત્યારે પણ મુદ્દો બોગસ એકાઉન્ટ્સ અને તેમના દ્વારા કરાતા પ્લેટફોર્મના દુરુપયોગનો મુદ્દો કારણ હતો.

ટ્વિટર ખરીદવામાં રસ ધરાવતી કંપનીઓની ઘિંતાઓનો ઉકેલ કંપની પાસે નહોતો. તેથી છેવટે બધી કંપનીઓ તેમાં આગળ ધપી નહીં. ટ્વિટરના બોર્ડે પણ કંપની વેચવાનો વિચાર માંડી વાળીને ૨૦૧૭ના જૂનમાં ડેશબોર્ડમાં સુધારો કરીને નવાં રૂપરંગ આપ્યાં. તેના કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ટ્વિટરના યુઝર્સ ધરખમ રીતે વધ્યા છે. ભારત પાસે પોતાનું જોરદાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ



નથી તેથી ટ્વિટર માટે ૪૪ અબજ ડોલર જેવી જંગી રકમની બોલી બોલાઈ તેનું લોકોને આશ્ચર્ય થયેલું. ટ્વિટરની એવી તે શું કમાણી છે કે મસ્ક જેવો પાકો બિઝનેસમેન આટલા બધા રૂપિયા તેમાં નાંખવા તૈયાર થઈ ગયો એવો સવાલ પણ લોકોને થાય છે. આ સવાલનો જવાબ મેળવવા ટ્વિટરનું બિઝનેસ મોડલ સમજવું જરૂરી છે. વિશ્વમાં ટ્વિટરના સક્રિય યુઝર્સની સંખ્યા લગભગ ૩૩ કરોડ છે. વિશ્વમાં યુઝર્સની રીતે ટ્વિટર સોળમા નબરનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. ૨૦૨૧માં ટ્વિટરની કુલ આવક ૫.૦૮ અબજ ડોલર સુધી પહોંચી હતી. તેમાંથી ૪.૩ અબજ ડોલર એડવર્ટાઈઝિંગમાંથી કંપનીને મળ્યા હતા. કંપની પોતાની પ્રોડક્ટ કે સર્વિસને લગતી સાદી ટ્વિટ કરે એ પ્રમોટેડ એડ છે. જ્યારે નવા ફોલોઅર બનાવવા ફોલોઅર એડ લેવાય છે. કોઈ મૂવી કે નવી પ્રોડક્ટ-સવસ ટ્વિટર ટ્રેન્ડ કરે

પ્રાસંગિક
ધવલ શુક્લ



હોવાથી મસ્કને તેમાં રસ પડી ગયો હોવાનું મનાય છે. ટ્વિટર સાથે મસ્કના સોદામાં એવી જોગવાઈ છે કે, મસ્ક અધવચ્ચે સોદો ફોક કરી નાંખે તો ૧ અબજ ડોલરની બ્રેક-અપ ફી તેણે ટ્વિટરને ચૂકવવી પડે. આ ફી ચૂકવવી નહીં પડે તે માટે મસ્ક ચાલાકી કરી રહ્યા છે. ભવિષ્યમાં સોદો થઈ શકે છે એવું ગાજર લટકાવીને મસ્ક બ્રેક-અપ ફી આપવામાંથી છટકાબારી શોધી રહ્યા છે. જો કે સામે પક્ષે ટ્વિટર પણ મસ્કની વાતોમાં આવી જાય તેમ નથી. ટ્વિટરે સામે સ્પષ્ટ કર્યું છે કે, મસ્ક અધવચ્ચે સોદો રદ કરીને ફરી ગયા હોવાથી કંપની પાસે કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે. મસ્કે કરાર પ્રમાણે બ્રેક-અપ ફી આપવી જોઈએ. આ અંગે કેસ પણ અમે કરીશું. મસ્કે ટ્વિટર ખરીદવામાં પીછેહઠ કરી તે ઘટના અણધારી નથી. કારણ કે, મસ્કે એપ્રિલમાં વિશ્વમાં સૌથી પ્રભાવશાળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

મસ્કના વિરોધીઓ કહે છે કે, સ્પામ બોટનું તો બહાનું છે, બાકી મસ્કને ટ્વિટર ખરીદવામાં નહીં પરંતુ તેનો ઉપયોગ કરીને રોકડી કરવામાં રસ હતો

એ પણ જાહેરખબર હોય છે. બે લાખ ડોલરની આસપાસ રકમ ચૂકવીને કશાને પણ ટ્રેન્ડ કરાવી શકાય છે. ડેટા લાયસન્સિંગ હેઠળ કંપનીઓ કે ડેવલપર્સને માગે એ પ્રમાણેનો ડેટા અપાય છે. ટ્વિટરે તેમાંથી ૨૦૨૧માં ૭૬ કરોડ ડોલરની કમાણી કરી હતી. આમ છતાં એક સમયે ટ્વિટરે ખોટ કરી હતી. કંપની પાસે ૧૪૦૦ કરોડ ડોલરની એસેટ્સ

સ્પામ બોટ મોટા પ્રમાણમાં હોય છે. ટ્વિટરે તો સત્તાવાર રીતે સ્પામ બોટ્સને મંજૂરી આપેલી છે. મોટી કંપનીઓ, રાજકીય પક્ષો, ધાર્મિક સંગઠનો વગેરે પોતાનો પ્રચાર કરવા, પોતાનો મત ફેલાવ એ માટે આ પ્રકારનાં એકાઉન્ટ્સ બનાવે છે.

મસ્કને પહેલેથી આવાં સ્પામ બોટ્સ સામે વાંધો હતો. મસ્કે સોદો કર્યો ત્યારે તેમાં જોગવાઈ કરેલી કે, કંપનીના કુલ યુઝર્સમાંથી ૮૫ ટકા જેન્યુઈન એટલે કે જીવતા જાગતા માણસો હોવો જોઈએ અને ૫ ટકાથી પણ ઓછા સ્પામ બોટ હોવા જોઈએ. કંપનીએ તેની ખાતરી આપેલી અને એ દિશામાં કામ શરૂ કરી દીધું હોવાનું વચન પણ આપ્યું હતું. આ બાબતથી સંતોષ માન્યા બાદ મસ્કે મે મહિનામાં ચેતવણી આપી હતી કે, ટ્વિટર સ્પામ બોટ નહીં ઘટાડે તો પોતે ખસી જશે. ગયા મહિને તણે ફરી ચીમકી આપી કે, ટ્વિટર ફેક અને સ્પામ એકાઉન્ટ અંગે અમે માંગેલો ડેટા નહીં આપે તો હું સોદામાં આગળ નહીં વધુ. મસ્કના આકરા વલણ બાદ ટ્વિટરે ગત અઠવાડિયે બે દિવસ પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે, અમે દરરોજ ૧૦ લાખ સ્પામ બોટ દૂર કરી રહ્યા છીએ અને તેનું પ્રમાણ કુલ યુઝર્સમાં ૫ ટકાથી પણ ઓછું છે. જો કે, ટ્વિટરની આ વાતથી મસ્કને સંતોષ ન થતાં તેમણે સોદો ફોક કરવાની જાહેરાત કરી દીધી.

હવે મસ્કના વિરોધીઓ કહે છે કે, સ્પામ બોટનું તો બહાનું છે, બાકી ટ્વિટર ખરીદવામાં મસ્કને રસ જ નહોતો. મસ્કને ટ્વિટરનો ઉપયોગ કરીને રોકડી કરવામાં રસ હતો અને એ બેલ તેણે કરી નાંખ્યો એટલે ટ્વિટરમાં તેને રસ રહ્યો નથી. મસ્કે ટ્વિટરનો સોદો કર્યો પછી ટ્વિટરના શેરનો ભાવ વધીને ૫૨ ડોલર સુધી પહોંચી ગયા હતા. ભાવ ઉચકાયા ત્યારે મસ્કે પોતાના તથા બીજા નામે લીધેલા શેર વેચીને જંગી કમાણી કરી લીધી. તેના કારણે શેરના ભાવ ઘટ્યા અને અત્યારે ૩૭ ડોલરની આસપાસ છે. મસ્કના કેટલાક વિરોધીઓ માને છે કે, મસ્ક ટ્વિટરને છોડશે તો નહીં જ. ટ્વિટરની તાકાત તેના સક્રિય યુઝર્સનો ક્લાસ છે. દુનિયામાં સૌથી પાવરફુલ મનાતા લોકો ટ્વિટર ઉપર સક્રિય છે. ટ્વિટરની મદદથી કોઈ પ્રોપેગેન્ડા બહુ સરળતાથી ચલાવી શકાતો હોવાથી દુનિયાના પાવરફુલ લોકો ટ્વિટરની આગળપાછળ ફરે છે.

મસ્કને પાવરમાં રસ છે, પાવરફુલ લોકોને પોતાના તાબામાં રહે તેમ છે. ટ્વિટરની મદદથી તેની આ મહત્વાકાંક્ષા પુરી થાય તેમ છે. આથી આ સોદામાં આજે નહીં તો કાલે મસ્ક ફરી તેના વિચારો બદલશે. હાલ મસ્ક મૌન ધારણ કરીને બેઠા છે.

ગુરુપૂર્ણિમા : ગુરુઓનો આભાર માનવાનો દિવસ

શિષ્યના જીવનમાંથી અંધકારને દૂર કરવા જ્ઞાનર્ષી ઈવો પ્રગટાવે તે ગુરુ કહેવાય છે, આ તહેવાર હિંદુ, શીખો, બૌદ્ધ અને જૈનો માટે મહાત્મ્ય ધરાવે છે

ભારતીય સંસ્કૃતિમાં “ગુરુ “ શબ્દ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. “ગુ”નો અર્થ અંધકાર અને “રુ”નો અર્થ અંધકાર દૂર કરનાર તેવો થાય છે. આ તહેવાર હિન્દુઓ, શીખો, બૌદ્ધો અને જૈનો દ્વારા પોતાના ગુરુજનોને આદર અને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્યો દ્વારા આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને ભેટ આદિ વસ્તુ ગુરુ ચરણે અર્પણ કરીને ગુરુ પૂજન કરવામાં આવે છે. કેમ કે, જીવનની સફળતા ભણી પહેલું ડગલું ભરવા પાછળ ગુરુ જવાબદાર હોય છે.

ગુરુનું મહત્વ આ શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે.

**अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया ।
चक्षुस्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥**

જે શિષ્યના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા શિષ્યની આંખોમાં જ્ઞાનરૂપી સળીથી અંજન કરીને શિષ્યમાં જ્ઞાનનો દીપક પ્રગટાવીને આંખોને ખોલે છે. તેને ગુરુ કહે છે.

■ ઓંશો રજનીશના શબ્દોમાં કહીએ તો “ગુરુનો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતના કે, જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે. પણ તમારા સ્થાન પર ઊભી છે, તમારી પાસે છે. થોડુંક ઋણ શરીર પ્રત્યેનું બાકી છે. તેને ચુકવવાની પ્રતિક્ષા છે. “સોળે કળાએ ચંદ્ર પ્રકાશિત હોય, તેને શરદ પૂર્ણિમા કહેવાય છે. તો પ્રશ્ન થાય કે, અષાઠ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે કેમ ઓળખવામાં આવે છે.?. આપણે પૌરાણિક આધારે ગૂઢ રહસ્યને વિસ્તૃત રીતે સમજીએ..

■ અષાઠ મહિનામાં ચંદ્રમા વાદળોથી ઘેરાયેલો હોય છે. તેથી તેના દર્શન દુર્લભ છે. આ અંધકારના ચાર મહિનામાં અતિગરમી કે અતિ ઠંડી હોતી નથી. તેથી આ સમય વિદ્યા પ્રદાન માટે ગુરુ અને શિષ્યના સંદર્ભમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એટલા માટે ગુરુચરણોમાં રહીને શિષ્ય જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગશક્તિની આરાધના કરે છે.



■ ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે, આજથી 3000 ઈસ. પૂર્વે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ છે. જેઓએ સર્વપ્રથમ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. તેમજ 18 પુરાણ અને 4 વેદોને પ્રકાશિત કરીને જગતને જ્ઞાનથી પ્રકાશિત કરી દીધું હતું. અષાઠ મહિનામાં ચંદ્રમા વાદળોથી ઘેરાયેલો હોય છે, તેવી રીતે વાદળો રૂપી શિષ્યો થકી ગુરુ ઘેરાયેલા હોય છે. અષાઠ મહિનામાં પણ વ્યાસજી શિષ્યોના જન્મોજન્મના અજ્ઞાન રૂપી અંધકારના વાદળોને દૂર કરીને જ્ઞાનરૂપી પૂર્ણિમાના તેજથી ભરી દે છે. આ એકમાત્ર પૂર્ણિમાની આરાધના કરવાથી આપુ વર્ષ પૂર્ણિમાનું ફળ પ્રાપ્ત થાય છે.

**गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥**
પ્રાચીન કાળમાં ગુરુઓ પોતાના ગુરુકુળમાં શિષ્યોને નિ:શુલ્ક વિદ્યા આપતા હતા. તેથી આ પર્વમાં ગુરુ દ્વારા કરવામાં આવેલી મહેનત, બલિદાન

તેમજ શિષ્ય પ્રત્યે સમર્પણ અને માન આપવા માટે આપણાં માટે ગુરુજનો, મહાપુરુષો, માતાપિતા અને પૂજનીય વ્યક્તિઓ માટે આભાર માનવાનો આ ઉત્તમ દિવસ છે.

ગુરુ શિષ્યોમાં એક નવો સકારાત્મક દ્રષ્ટિકોણને આ દિવસ દિશા પૂરી પાડે છે. તે ગુરુ પાસે શિક્ષણ લેવા જાય છે, ત્યારે નાના બીજ સમાન હોય છે. પછી ગુરુનાં સાનિધ્યમાં વટવૃક્ષનું રૂપ ધારણ કરે છે અને બીજાને છાંયડો આપે છે.

બૌદ્ધ ધર્મમાં અને જૈન ધર્મમાં ગુરુપૂર્ણિમાનું મહત્વ

■ પુરાણો અનુસાર ભગવાન શિવજી પ્રથમ ગુરુ છે. તેઓએ પૃથ્વી ઉપર સૌથી પહેલાં ધર્મ અને સભ્યતાનો પ્રચાર કર્યો હતો. તેથી તેઓને આદ્યગુરુ કે આદિ ગુરુ શંકર પિતા કહેવાય છે. શિવજીએ પરશુરામ અને શનિ દેવને પ્રથમ શિક્ષણ આપ્યું હતું. ગુરુપૂર્ણિમા બૌદ્ધ ધર્મ માટે ખુબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. મહાત્મા બુદ્ધે વર્તમાનમાં વારાણસીના સારનાથ ખાતે પાંચ ભિક્ષુઓની સભામાં પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જે આજે ધર્મ પ્રવર્તકના નામે ઓળખાય છે.

■ જૈન ધર્મમાં પણ ગુરુ પૂર્ણિમાના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારણ કે, આ દિવસે જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ ગાંધાર રાજ્યના શ્રી ગૌતમ સ્વામીને પોતાના પ્રથમ શિષ્ય બનાવ્યા હતા. જેનાથી તે “ ત્રિલોક ગુહા”ના નામથી પ્રખ્યાત થયા. જેનો અર્થ થાય છે “ પ્રથમ ગુરુ”

શીખ ધર્મની પ્રચલિત કહેવત (દોહો) છે..
“ ગુરુ ગોવિંદ દોનું ખડે કા કે લાગુ પાય,
બલિહારી ગુરુ આપ ને ગોવિંદ દિયો બતાય.”
આમ શીખધર્મ માત્ર એક ઈશ્વર અને પોતાના 10 ગુરુની વાણીને જ જીવનનું વાસ્તવિકસત્ય માને છે.

ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજા કરવાની વિધિ જાણો

પુરાણો અનુસાર સર્વ પ્રથમ સવારે ખુબ વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ અને શુદ્ધવસ્ત્રો ધારણ કરીને ગૃહ મંદિરના શિવજીને, ભગવાન વિષ્ણુને, બૃહસ્પતિ અને પછીથી વેદવ્યાસનું સ્મરણ કર્યા બાદ પોતાના ગુરુના ઘરે જઈને તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવા.


■ ગુરુ પૂજાની સામગ્રી : (1) નાગરવેલનું પાન (2) પીળા રંગનું વસ્ત્ર (3) પીળા રંગની મીઠાઈ. (4). શ્રીફળ (નારિયેળ) (5) ફૂલો (6) એલચી (7) કપૂર (8) લવિંગ સાથે લઈને જવું જોઈએ. ગુરુના ગુણનો પાર નથી. ગુરુએ આપેલા જ્ઞાન દ્વારા જ શિષ્ય યોગ્યતા પ્રાપ્ત કરીને જ પ્રકાશમાન દિપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી (દર્શન) કરી શકે છે. જન્મ અને સંસ્કાર આપનારી માતા પછી ગુરુ જ વિશિષ્ટ રીતે પોતાના શિષ્યોને જેમ યાજ્ઞક્ય દ્વારા ચંદ્રગુપ્તને યોગ્ય માર્ગદર્શન આપીને દેશને ઉત્તરિનો પંથ બતાવ્યો અને દેશને પ્રગતિના સોપાનો સર કરાવ્યા, તેવી રીતે સામાજિક વિપદા સામે લડવા માટે સજ્જ કરીને ગુરુ પોતાના શિષ્યને નવજીવન પુરું પાડે છે. અંતમાં ગુરુના ગુણને વર્ણવતા મારા રચેલાં ગીત દ્વારા આ લેખનું સમાપન કરીશ.

ગુરુની પ્રેમની વાણી, અમોને યાદ રહી જાશે,
ગુરુની પ્રેમ આશિષો, અમોને યાદ રહી જાશે...
પુરાણોમાં અમર બની ગયો એકલવ્ય તો, ગુરુની મૂર્તિની પાસે તીરંદાજી ચલાવતો,
ગુરુ કાજે અંગૂઠાની, કુરબાની યાદ રહી જાશે..
ગુરુની પ્રેમની વાણી અમોને યાદ રહી જાશે.
કદીયે ના ભુલાયે વિંદગીમાં, ગુરુ પૂર્ણિમા,
ભરીઘો જ્ઞાન નો સાગર, અમારી ઊર્મિઓમાં,
ગુરુની લાગણીઓની સરિતા યાદ રહી જાશે..
ગુરુની પ્રેમની વાણી અમોને યાદ રહી જાશે.
(કવિ : ડો.જયેન્દ્ર નાયક અમદાવાદ)

Event organized by Gayatri Pariwar Yugnirman Canada and DIYA Canada

ADHYATMIK SHAKTIYON KA AADHAR SHRADDHAA

Evening Discourse By:



Guest Speaker
Aadarniya Dr. Chinmay Pandya
Pro-Vice Chancellor, Dev Sanskriti Vishwa Vidyalaya (DSVV), Haridwar, India

DATE: Sunday, July 24, 2022
TIME: 7PM to 9PM ET
VENUE: Hindu Heritage Centre | 6300 Mississauga Road, Mississauga, L5N 1A7

Contact Information:

Mayur Patel 905 453 0878	Madhubhai Patel 647 227 8590	Bhaktiben Desai 905 273 9440
Sharadbhai Patel 905 660 9291	Piyush Modi 647 988 9591	Shashikant Patel 905 653 7173

FREE ENTRY

RSVP REQUIRED

Gayatri Pariwar Yugnirman Canada
invites your family and friends to
Annual Family Picnic

Sunday, July 17 2022 12PM to 7PM

Paul Coffee Park (Shade B) 3430 Derry Road East, Mississauga L4T 1A9

SCHEDULE

Potluck Lunch: 1:00 PM
Picnic Games, Yoga, Sports and Fun
Activities: 1:00 PM to 6:00 PM
Evening Prayer: 6:00 PM
Dinner (Khichdi): 6:30 PM

PICNIC DETAILS

Please bring one snack item for potluck, picnic chairs, and yoga mats

RSVP: <https://bit.ly/GPYNPICNIC>

CONTACT INFORMATION

For more information, please email us at gpyncanada@outlook.com or call one of the members.

Oakville - Milton Madhubhai Patel 647 227 8590	Vaughan Shahshikant Patel 905 653 7173	Brampton Mayurbhai Patel 905 453 0878	Caledon Sangeetaben Patel 647 531 4125
Brampton Naimishaben Patil 289 218 8864	Brampton Sumitraben Prajapati 905 497 4799	Mississauga Bhaktiben Desai 905 273 9440	



પૂર્ણાના પૂરમાં નવસારી ડુબ્યુ : હાઈવે બંધ

આહવા, સાપુતારા, ડાંગમાં ભારે વરસાદના પાણી નદીમાં આવ્યા અને ભરતીને કારણે દરિયાએ પાણી લીધું નહીં

નવસારી

વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતાં બરુડિયાવડ વિસ્તારમાંથી 350થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

એક જ રાતમાં નવસારીના વાંસદામાં આભ ફટકું છે. વાંસદા તાલુકામાં ગુરુવારે સવારે ૬ વાગ્યે પુરા થતા ૨૪ કલાકમાં ૩૮૪ મિમી વરસાદ આકાશમાંથી ઝીંકાયો છે. વાંસદામાં ૨૪ કલાકમાં ૧૫.૭૬ ઈંચ વરસાદ નોંધાતા ચોમેર પાણી પાણી થઈ ગયું છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ કારણે નવસારીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ બની છે. નવસારીની પૂર્ણા નદી કિનારાના ગામડાઓ અને નવસારી-ચીખલી તથા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. છેલ્લા ૪ દિવસોમાં નવસારી શહેરની લોકમાતા પૂર્ણા નદીમાં પુરની સ્થિતિ બનતા હજારો લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઘરોમાં કેડસમા દૂષિત પાણી હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. વરસાદી પાણીને લીધે નવસારીના સાંતાદેવી રોડ, ટાવર, સેન્ટ્રલ બેંક, મધુમતિ જેવા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા હતા. બીજી તરફ વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતાં બરુડિયાવડ વિસ્તારમાંથી ૩૫૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું.

ચીખલીમાં ફસાયેલા નાગરિકોને ચોપર દ્વારા એરલિફ્ટ કરાયા



ડાંગ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી અવિતર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદથી ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે. બીજી તરફ જંગલના રસ્તાઓમાં ભેખડ ધસી પડવાના બનાવો બની રહ્યા છે. ડાંગના સુબીર તાલુકાના ભરડીપાડા-મહાલ માર્ગ પર ભેખડ ધસી પડતા લોકો ફસાયા હતા. વધુમાં ડાંગમાં પડેલા વરસાદને કારણે નવસારીના અનેક વિસ્તારોમાં પૂર આવ્યા છે. કાવેરી નદી કિનારે આવેલા ચીખલી તાલુકાના સાદકપુર ગામે ગોલવાડ અને ખુંદ ગામે નદી ફળિયામાં રહેતા 12 લોકો ગુરુવારે પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ વહીવટી તંત્રને કરવામાં આવતા ફસાયેલા તમામને હેલિકોપ્ટરની મદદથી સલામત સ્થળે ખસેડાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ નવસારી જિલ્લામાં એનડીઆરએફની ટીમે 100થી વધુ લોકોને બોટની મદદથી બહાર કાઢ્યા હતા. ચીખલી-કસબામાંથી 86 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું સરકાર તમારી પડખે છે

નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વિકટ છે. અહીં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લભારે વરસાદને કારણે નુકસાન પણ થયું છે. આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોના જાતનિરીક્ષણ મુલાકાત દરમિયાન મોચી સમાજની વાડી, કાલિયાવાડી ખાતેના શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી. તેમણે અહીં નીચાણવાળા વિસ્તાર વોરાવાડથી સ્થળાંતરિત કરવામાં આવેલા અસરગ્રસ્તો સાથે સંવાદ કરી 'સરકાર આ વિપદામાં તેમની પડખે છે' તેવો સંદેશ આપ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મેઘમહાર : અનેક નગરો જળબંબાકાર

રાજકોટ

સૌરાષ્ટ્રમાં અષાઢ મહિનાનાં આગમન સાથે આવી પહોંચેલી મેઘસવારી ૧૫ દિવસ બાદ પણ યથાવત રહી હતી. ગુરુવારે પણ મેઘમહાર વચ્ચે સૌરાષ્ટ્રનાં ૩૧ તાલુકા મથકોએ અડધાથી આઠ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અને અમરેલી જિલ્લામાં જળબંબાકાર સર્જાયો હતો.

જૂનાગઢ : ગત મધરાતથી જ વરસાદ વરસવો ચાલુ થયો હતો, જે આજે સવારથી વેગવંતો બન્યો હતો. સૌથી વધુ માણાવદરમાં રાત્રે બે ઈંચ અને દિવસે છ ઈંચ મળીને આઠ ઈંચ વરસાદ વરસી પડતા જળબંબાકારની

સ્થિતિ સર્જાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છ - સાત ઈંચ વરસાદથી અનેક ગામડાં બેટમાં ફેરવાઈ ગયા હતાં.

ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે મેંગરાજાએ તોફાની બેટીંગ કરી હતી. સુત્રાપાડા અને તાલાલામાં મુશળધાર છ-છ ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ નિર્માણ પામી હતી. નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં અને ખેતરોમાં ધોવાણ સહિતની ખાનાખરાબી પણ સર્જાઈ હતી. જયારે વેરાવળ અને ઉનામાં ધોધમાર દોઢ ઈંચ તથા કોડિનારમાં એક ઈંચ વરસાદથી નિચાણનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

પોરબંદર : જિલ્લામાં પણ ગઈકાલે

રાતથી ધીંગી મેઘસવારી આવી પહોંચી હતી. રેડ એલર્ટની આગાહીને સાર્થક કરતો હોય એમ સાંબેલાધારે વરસાદ વરસી પડ્યો હતો. આજે સાંજ સુધીમાં રાણાવાવમાં ૬ ઈંચ તથા પોરબંદર અને કુતિયાણામાં ૫-૫ ઈંચ વરસાદથી ઘેડ પંથક તો જળબંબાકાર થઈ ગયો હતો.

અમરેલી : ધીમીધારે ઝાપટાથી અહીં ઈંચ સુધી મેઘમહેર વરસી હતી. જેમાં ખાંભામાં અઢી ઈંચ, વડિયા અને રાજુલામાં બે ઈંચ, સાવરકુંડલામાં દોઢ ઈંચ, ધારીમાં એક ઈંચ, અમરેલીમાં પોણો ઈંચ અને જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે લાઠી અને બાબરામાં ઝાપટાથી માર્ગો ભીના થા હતાં.



જામખાટલીમાં કલાકમાં સાડા છ ઈંચ

જામકંડોરણા તાલુકામાં આજે બપોર બાદ આભ ફટકું હોય એમ વરસાદ વરસ્યો હતો. જેમાં જામખાટલી ગામે માત્ર એક કલાકમાં સાંબેલાધારે સાડા છ ઈંચ વરસાદ ખાબકી પડતા ગ્રામજનો ફક્તી ઉઠ્યા હતાં.

વરસાદ બાદ રાજ્યની 207 જળ પરિયોજનામાં 46.91% જળસંગ્રહ

રાજ્યના 27 જળાશયો હાઈ એલર્ટ અને 12 જળાશયો એલર્ટ ઉપર અમદાવાદ

રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 46.91% જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,60,૩૬૩ એમસીએફટી જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 48 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર તા. 13 જુલાઈ, 2022ની સ્થિતિએ રાજ્યભરમાં 21 જળાશયો એવા છે કે જેમાં 100%થી વધુ જળસંગ્રહ થયો છે. 30 જળાશયોમાં 70% થી 100% જળસંગ્રહ,

27 જળાશયોમાં 50% થી 70% જળસંગ્રહ, 51 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 25% થી 50% જળસંગ્રહ, 77 જળાશયોમાં 25% કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો, સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100% થી વધુ જળસંગ્રહ થયેલ 21 જળાશયો તથા 90% થી 100% જળસંગ્રહ થયેલ 6 જળાશયો મળી કુલ 27 જળાશયો હાઈ એલર્ટ ઉપર છે.

SHIV FINANCIAL SERVICES

Serving Community Since 2009
Canada

BEST RATES AVAILABLE



FREE PERSONAL TAX-FILE FOR NEW IMMIGRANTS



SUPER VISA MEDICAL INSURANCE & VISITOR TO CANADA MEDICAL INSURANCE

JAGDISHBHAI SEVAK
Insurance Broker

647-236-7620

sevak_2007@hotmail.com • www.shivfinancialservices.ca

"PROPER INSURANCE COVERAGE IS PEACE OF MIND"



બુમરાહ વન ડે
બોલર્સ રેન્કિંગમાં
ત્રણ સ્થાનની છલાંગ
સાથે ફરી નંબર વન



દુબઈ: ભારતીય ફાસ્ટ બોલર બુમરાહે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ઝંઝાવાત જગાવતા માત્ર ૧૯ રનમાં જ છ વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો હતો. જેના પરિણામે તે આઈસીસી વન ડે બોલર્સ રેન્કિંગમાં ત્રણ સ્થાનના સુધારા સાથે ફરી નંબરવન બની ગયો હતો. જ્યારે ત્રણ વિકેટ ઝડપનારા ફાસ્ટ બોલર શમીએ ચાર સ્થાનના સુધારા સાથે ૨૩મું સ્થાન હાંસલ કર્યું હતું. અગાઉ બે વર્ષ ટોચ પર રહ્યા બાદ ફેબ્રુઆરી, ૨૦૨૦માં બુમરાહે ટોચનું સ્થાન ગુમાવ્યું હતું અને ન્યુઝીલેન્ડના બોલ્ટને આ તાજ મળ્યો હતો. તે ૭૩૦ દિવસ ટોચ પર રહ્યો હતો, આટલા દિવસ અન્ય કોઈ ભારતીય ટોચ પર રહી શક્યો નહતો. બુમરાહ અગાઉ ટી-૨૦માં ટોચનું સ્થાન મેળવી ચુક્યો છે અને હાલમાં તે ટેસ્ટ બોલર્સમાં ત્રીજા સ્થાને છે. કપિલ દેવ બાદ તે આઈસીસી વન ડે બોલર્સ રેન્કિંગમાં ટોચ પર પહોંચનારો બીજો ભારતીય ફાસ્ટર છે.

બીજી વન ડે: રીસ ટોપ્લેની ઘાતક બોલિંગ ઈંગ્લેન્ડએ ભારતને 100 રને હરાવ્યું

લોર્ડઝ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરીઝની બીજી મેચ લોર્ડઝમાં રમાઈ રહી છે. પહેલાં બેટિંગ કરતા ઈંગ્લેન્ડ 246 રન બનાવ્યા છે. ભારત તરફથી સૌથી વધુ વિકેટ યુજવેન્દ્ર ચહલે લીધી. તેને 4 વિકેટ પોતાના નામે કરી. તો જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન મોઈન અલીએ બનાવ્યા. તેને 64 બોલમાં 47 રનની ઈનિંગ રમી. 247 રનનો લક્ષ્યાંક પાર કરવા ભારતીય ટીમ 38.5 ઓવરમાં 146 રન બનાવી શકી હતી. રીસ ટોપ્લેની ઘાતક બોલિંગ વડે ઈંગ્લેન્ડે ભારતને 100 રને હરાવ્યું હતું. રીસ ટોપ્લેએ ભારત વિરુદ્ધ 9.5 ઓવરમાં 2 મેડઈન ઓવર નાંખી 24 રન આપી છ વિકેટ ખેરવી હતી.

ટીમ ઈન્ડિયા તરફથી યુજવેન્દ્ર ચહલે કમાલની બોલિંગ કરી અને એકપણ ઈંગ્લિશ બેટ્સમેનને કીઝ પર ટકવા ન દીધા. ઈંગ્લેન્ડને બીજો ઝાટકો જોની બેયરસ્ટોનો લાગ્યો. તેને યુજવેન્દ્ર ચહલે બોલ્ડ કર્યો. ચહલના કુલર બોલ પર બેયરસ્ટો સ્લોગ સ્વીપ મારવા ગયો પરંતુ તે ચુકી ગયો. બોલ સીધો જ સ્ટમ્પ પર લાગ્યો. બેયરસ્ટોએ 38 બોલમાં 38 રન કર્યા.

પહેલી વન ડેમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું

પ્રથમ ODI મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ શરૂઆતથી મજબૂત બોલિંગ કરી ઈંગ્લેન્ડની હાલત બગાડી હતી અને માત્ર 26ના સ્કોર પર અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોના ઘાટાદાર પ્રદર્શનની સામે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 25 ઓવર ૪ ટકી શકી હતી અને આખી ટીમ માત્ર 25 ઓવરમાં પોવિલીયન ભેગી થઈ ગઈ હતી. આ મેચમાં જસપ્રિત બુમરાહે 7.2 ઓવરમાં 6 વિકેટ જ્યારે મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 3 વિકેટ લીધી હતી. જે બાદ ભારતીય ઓપનર કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર બેટિંગ કરી ભારતને 10 વિકેટથી શાનદાર જીત અપાવી હતી.

ODIમાં સૌથી ઝડપી
150 વિકેટ લેનાર
ભારતીય બોલર
બન્યો મોહમ્મદ શમી



મોહમ્મદ શમીએ આ સાથે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, હવે તે વન ડેમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. મોહમ્મદ શમી પહેલા આ રેકોર્ડ અજીત અગરકરના નામે હતો, જેણે 97 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી.

વિન્ડિઝ પ્રવાસમાં ટી-20
ટીમમાં કોહલીને ભારતીય
ટીમમાં સ્થાન નહીં

નવીદિલ્હી: કુંગાળ ફોર્મનો શિકાર બનેલા કોહલીને વિન્ડિઝ સામેની પાંચ ટી-૨૦ની શ્રેણી માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતના મોટાભાગના ટી-૨૦ના સ્ટાર ખેલાડીઓ વિન્ડિઝ સામેની શ્રેણી રમવાના છે. ઈંગ્લેન્ડ પ્રવાસથી ભારત ટી-૨૦માં મોટાભાગે એવા જ ખેલાડીઓને તક આપશે કે જેઓ ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન મેળવવાના દાવેદાર હોય.

બ્રિટનમાં ગેરકાયદે પ્રવેશ મેળવવા અંગેના ફરાહના દાવા બાદ પોલીસ તપાસ શરૂ

લંડન

ઈંગ્લેન્ડ માટે ઓલિમ્પિકમાં ચાર ગોલ્ડ મેડલ જીતનારા ૩૯ વર્ષના એથ્લીટ મો ફરાહે ખુલાસો કર્યો હતો કે, બાળપણમાં મને ગેરકાયદે બ્રિટનમાં ઘુસાડવામાં આવ્યો હતો. જે પછી ભારે વિવાદ સર્જાયો છે. ઈંગ્લેન્ડની પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી દીધી



છે. જોકે બ્રિટિશ સરકારે મો ફરાહને ખાતરી આપી છે કે, તેનું નાગરિકત્વ

પાછું ખેંચવામાં નહીં આવે. બ્રિટિશ વડાપ્રધાનના પ્રવક્તાએ તેને સ્પોર્ટિંગ હિરો તરીકે ઓળખાવ્યો હતો.

મો ફરાહે અગાઉ એવી જાહેરાત કરી હતી કે, તેના પિતા બ્રિટનમાં આઈટી એન્જિનિયર તરીકે કામ કરતાં હતા અને તે તેની માતા અને બે ભાઈઓ સાથે શરણાર્થી તરીકે બ્રિટનમાં આવ્યો હતો.

|| Jay Shree Swaminarayan ||

Ved Ratna Acharya Shree Purushottampriyadasji Swamiji Maharaj

ASTHI VISARJAN

at

NIAGARA FALLS

Thursday, July 28, 2022

9:00am - 11:00am

Address
Between Former Toronto Power House &
Niagara PKWY - Dufferin isle Rd intersection

More Info Call:

Dasbhai Patel Surendra Pujara
(647) 828-9579 (416) 825-1848

Tikubhai Thaker
(647) 773-6638



Inspirator: Acharya Swamiji Maharaj

MANINAGAR SHREE SWAMINARAYAN GADI SANSTHAN
SHREE SWAMINARAYAN TEMPLE - TORONTO

@SgadiToronto

Swaminarayangadi.com/northamerica



INVITATION

Maninagar Shree Swaminarayan Gadi Sansthan
Shree Swaminarayan Temple - Toronto, Canada
Cordially invites you, your family and friends to celebrate its

8th Patotsav

(Anniversary Celebration)

Saturday, July 30th, 2022
8:30am to 12:30pm

Patotsav Ceremony followed by Annkut
Darshan, Aarti, Ashirwad and Maha Prasad.

VENUE


Shree Swaminarayan Temple
6540 Kingston Rd, Toronto, M1C1L4

Surendra Pujara
(416) 825-1848

Tikubhai Thaker
(647) 773-6638

Dasbhai Patel
(647) 828-9579

Prakash Chauhan
(647) 703-4040



Ved Ratna


Shree Purushottampriyadasji
Swamiji Maharaj



INSPIRATOR :

ACHARYA SHREE JITENDRIYAPRIYADASJI
SWAMIJI MAHARAJ





CLUB CERAMIC

Porcelain Tiles : Premium Quality and Best Price

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking



TILES • BACKSPLASH • LAMINATE • VINYL • HARDWOOD

MONTREAL

3590, Rue Griffith, Saint Laurent,
QC, H4T 1A7
Phone: +1-514-260-2242 /
+1-514-813-3850

OTTAWA

Unit #4+5, 200
Colonnade Road,
Nepean, ON, K2E 7M1
+1-613-601-1474

MISSISSAUGA

5030 Maingate Drive, Unit#1,
Mississauga, L4W 1X5
Phone: +1 (647) 527-6030 /
+1-514-813-3850

CAMBRIDGE

15 Sheldon Dr, Cambridge,
ON N1R 6R8
+1-647-542-1508 ,
+1-647-527-6030

<https://clubceramic.com> Email : sales@clubceramic.com



ARSHA VIDYA

PRESENTS TWO HALF DAY RETREATS BY

SWAMINI PARAPRAJNANANDA SARASWATI

Retreat-1

(Topic: The Six-Fold Samadhi)

When: Saturday, 23 JULY 2022

Time: 8:30 AM to 12:30 PM

Venue: Anand Bhavan Seniors Home, Vishnu Mandir,
8642 Yonge Street, Richmond Hill, L4C 6Z4

Retreat-2

(Topic: Success Through Karma Yoga)

When: Sunday, 24 JULY 2022

Time: 8:30 AM to 12:30 PM

Venue: Room# 4, Loafers Lake Recreation Centre,
30 Loafers Lake Ln, Brampton L6Z 1X9



Swamini Paraprajanandaji
Tattvatirtha, Ahmedabad

Swamini Paraprajanandaji Saraswati is an erudite Sanyasini well versed with the knowledge of the Scriptures- Upanishads, Bhagavad Gita, Brahmasutra and other Vedantic texts. She is a senior disciple of Swami Vidatmananda Saraswati, Adhyatma Vidya Mandir, Ahmedabad.

Swamini Paraprajanandaji Saraswati has been teaching Vedanta for the past 20 years in India. She has also conducted series of talks on Vedanta in different cities of USA and Canada since 2016. Swaminiji abides in the knowledge of the self and is also expert in imparting this knowledge to others. The depth of Swaminiji's wisdom and her art of teaching which is at once profound and lucid make her an expert teacher from whom learning is a joy.

Swamini Paraprajanandaji Saraswati's experience as a professor of English in the past facilitates her to adeptly handle the subject at hand and communicate it to the audience. Besides being a gifted teacher, Swaminiji is also very simple, loving and compassionate as a person.

Registration fee for each retreat is \$20.00 (\$40 for both)

A light breakfast will be served.

Please register ONLINE at: WWW.ARSHAVIDYA.CA

(Limited sitting for both Retreats)

You may contact for details: Rajesh Patel (416) 846-5282, Mahendra Shah (905) 773-2689